


1	નીચે પૈકી કઈ કસોટી અભિયોજ્યતા કસોટી નથી ? (A) કારકૂની અભિયોજ્યતા કસોટી (B) ટેસ્ટ ઓફ ક્રિએટિવિટી (C) કે.જી.ટેસાઈની ઝડપ અને ચોકસાઈની કસોટી (D) રિખવચંદ પી. શાહની અંકશક્તિ કસોટી
2	રસમાપન અંગેની પ્રાથમિકતા સંશોધનિકાની રચના ઈ.સ.1939 માં ક્યા મનોવૈજ્ઞાનિકે કરી હતી ? (A) જી.એફ.કુડર (B) ઈ.કે.સ્ટ્રોગ (C) ગિલફર્ડ (D) ગાર્ડનર મર્ફી
3	ગિલફર્ડના મતાનુસાર રસનાં કુલ કેટલાં લેવો છે ? (A) 18 (B) 28 (C) 38 (D) 48
4	અધ્યયનની ઉપનિષદ પ્રવિધિનું મુખ્ય અંગ નીચે પૈકી કયું છે ? (A) એકાગ્રતા (B) પ્રશ્ન (C) જ્ઞાન (D) સંવાદ
5	ઈવાન પેટ્રોવિચ પાવલોવે પોતાના શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ ક્યા પ્રાણી પર કર્યો હતો ? (A) કૂતરો (B) બિલાડી (C) ઉદર (D) ચિંપાંચી
6	જર્મન શબ્દ 'મેસ્ટાલ્ટ'નો અર્થ શું થાય ? (યોગ્ય ક્રમ પસંદ કરો.) 1. તરાહ 2. સમાક્રમિત 3. આકાર 4. તરાહ, સમાક્રમિત અને આકાર (A) 1 અને 2 (B) 1 અને 3 (C) 2 (D) 4
7	વ્યક્તિત્વ એ કેવો શબ્દ છે ? (A) નવીન (B) સંબંધમૂલક (C) કર્તરિપ્રયોગ (D) સંકુચિત
8	'વ્યક્તિ પોતાની મહત્તમ શક્તિઓનું પ્રદર્શન પોતાનાં કાર્યો અને વર્તન દ્વારા વ્યક્ત કરે છે.' તે પદ્ધતિ એટલે ... (A) આત્મઅભિવ્યક્તિ (B) આત્મનિરીક્ષણ (C) રોજનીશી (D) પ્રયોગ
9	અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતર વ્યવહાર એટલે શું ? (A) શિક્ષણ વ્યવહાર (B) શિક્ષક-વિદ્યાર્થી વ્યવહાર (C) વર્ગવ્યવહાર (D) તમામ
10	વર્ગવ્યવહાર દરમિયાન વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા માટે પ્રો. નેડ ફ્લેન્ડર્સે શિક્ષક-વિદ્યાર્થીના વર્ગવ્યવહારના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે ? (A) 3 (B) 5 (C) 10 (D) 12
11	એકસરખી ઉમર ધરાવતાં અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતાં બાળકોને શું કહેવાય ? (A) સમોવડિયા (B) સહાધ્યાયી (C) સહપાઠી (D) એકવડિયા
12	મૂલ્યાંકન પ્રક્રિયા માટે આપેલ લક્ષણો પૈકી યોગ્ય ક્રમ પસંદ કરો. 1. હેનુકેન્ડ્રી 2. પરોક્ષ અને સાપેક્ષ 3. માપન પ્રક્રિયા 4. તમામ (A) 1 (B) 2 (C) 3 (D) 4
13	મૂલ્યાંકન અંતર્ગત નીચે પૈકી કઈ કસોટી અનોપચારિક પ્રકારની છે ? (A) સંગૃહિત માહિતીપત્રક (B) ક્રિયાત્મક કસોટી (C) ક્રમમાપદંડ (D) પ્રશ્નાવલી
14	નીચે પૈકી કયું લક્ષણ ક્રિયાત્મક કસોટીનું લક્ષણ નથી ? (A) આ એક અનોપચારિક કસોટી છે. (B) આ કસોટીથી જ્ઞાન, સમજ, ઉપયોજનનું માપન થઈ શકે છે. (C) વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન થાય છે. (D) લેખિત અને મૌખિક કસોટીની પૂરક કસોટી છે.
15	સત્ત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો ખ્યાલ શામા રજૂ થયો છે ? (A) કોઠારી શિક્ષણ પંચ (B) મુદાલિયર શિક્ષણ પંચ (C) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 (D) રાધાકૃષ્ણન શિક્ષણ પંચ
16	કઈ કસોટી અંતર્ગત વિદ્યાર્થીએ આપેલ જવાબથી એ સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પૂરક પ્રશ્ન પૂછી શકે છે ? (A) લેખિત કસોટી (B) મૌખિક કસોટી (C) ક્રિયાત્મક કસોટી (D) તમામ
17	'જો વિદ્યાર્થીઓમાં જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટી જોડણી લખતા અટકશે.' - વિધાન ક્રિયાત્મક સંશોધનના ક્યા સોપાનને સાર્થક કરે છે ? (A) સમસ્યા (B) ઉત્કલ્પના (C) પૃથક્કરણ અને અર્થઘટન (D) સંભવિત કારણો









	(A) 5	(B) 4	(C) 3	(D) 2
19	નીચે પૈકી કઈ જોડણી સાચી નથી ?			
	(A) ભૂરિશ્રવા	(B) આશીર્વાદ	(C) ગુપ્ત	(D) કમાલ
20	'પતીજ' નો સાચો સમાનાર્થી શોધો.			
	(A) સંતાન	(B) પત્રાણું	(C) વિશ્વાસ	(D) પવિત્ર
21	'બધે છે આદ્રતા છાઈ તેમાં કં ભળવું ભલું.' આ વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શું થાય ?			
	(A) શુષ્કતા	(B) ભીનાશ	(C) મુદ્દતા	(D) એકપણ નહિ
22	વિરામચિહ્નેને ધ્યાનમાં રાખીને સાચું વિધાન શોધો.			
	(A) બાએ કહ્યું, "જા-તું કવે અમારા લેણામાંથી છૂટે."	(B) બાએ કહ્યું, "જા, તું કવે અમારા લેણામાંથી છૂટે."	(C) બાએ કહ્યું, "જા ! તું કવે અમારા, લેણામાંથી છૂટે."	(D) બાએ કહ્યું - "જા, તું કવે, અમારા લેણામાંથી છૂટે !"
23	'તેણે અજપામાં રાત વિતાવી.' - વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે ?			
	(A) કર્મ	(B) ક્રિયાવિશેષણ	(C) ક્રિયાપદ	(D) અવ્યય
24	'તે સ્કૂલમાં ચાલીને ગઈ.' - વાક્યમાં રેખાંકિત પદનો ફૂદત પ્રકાર ઓળખો.			
	(A) ભવિષ્ય ફૂદત	(B) સંબંધક ભૂતફૂદત	(C) ફેવલઈ ફૂદત	(D) વર્તમાન ફૂદત
25	'કન્યાઓએ ભણવું જોઈએ.' - વિધાનનું પ્રેરક વિધાન શોધો.			
	(A) કન્યાઓને ભણાવવું જોઈએ.	(B) કન્યાઓથી ભણાય છે.	(C) કન્યાઓથી ભણાવવું જોઈએ.	(D) કન્યાઓ ભણે છે.
26	'મારાથી અંદર જવાયું.' - વાક્યનો પ્રકાર કયો છે ?			
	(A) પ્રેરક વાક્ય	(B) ભાવે વાક્ય	(C) કર્તારિ વાક્ય	(D) કર્મણિ વાક્ય
27	ક્યા વિકલ્પમાં બિનગુજરાતી શબ્દવાળું વાક્ય છે તે નક્કી કરો.			
	(A) માની વાત જ ન્યારી	(B) મા તે મા, બીજા બધા વગડાના વા	(C) ક્યારેય પણ માની કસમ ખાવી નહીં	(D) મા ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે.
28	"અમારી શાળામાં શિક્ષણમંત્રી આવ્યા હતા." - વાક્યમાં સમયવાચક ક્રિયાવિશેષણ તરીકે નીચે પૈકી શું ઉમેરી શકાય ?			
	1. આજે	2. એકવાર	3. ગયા અઠવાડિયે	4. આ તમામ
	(A) માત્ર 1	(B) માત્ર 2	(C) માત્ર 3	(D) 4
29	'વિદ્યુત્ + લેખો' - માટે યોગ્ય શબ્દ શોધો.			
	(A) વિદ્યુલેખા	(B) વિદ્યુતલેખા	(C) વિદ્યુલેખા	(D) એકપણ નહિ
30	'પરિણીત' શબ્દમાં વપરાયેલ પ્રત્યય ઓળખો.			
	(A) પરિ	(B) ઈત	(C) ઈત	(D) અણીત
31	'સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભંગ.' - વાક્યમાં રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.			
	(A) દ્રવ્ય સમાસ	(B) તત્પુરુષ સમાસ	(C) અવ્યયીભાવ સમાસ	(D) કર્મધારય સમાસ
32	નિબંધના લખાણને કુલ કેટલા ભાગમાં વહેચી શકાય છે ?			
	(A) એક	(B) બે	(C) ત્રણ	(D) પાંચ
33	રેખાંકિત શબ્દના સમાસનો પ્રકાર જણાવો. - શેઠે એને સાચપાઉ તરીકે આજુબાજુની કીટલી ફેરવતો કરી દીધો.			
	(A) દ્રવ્ય	(B) તત્પુરુષ	(C) કર્મધારય	(D) ઉપપદ

34	યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગનો કયા વર્ષનો અહેવાલ 21મી સદીનો 'શિક્ષણ ગીતરનો પાઠનો' તરીકે આગળવાળો છે?	(A) ઈ.સ. 1996	(B) ઈ.સ. 1997	(C) ઈ.સ. 1998	(D) ઈ.સ. 1995
35	આત્મસાક્ષાત્કારનો સમાવેશ કેળવણીના કયા પ્રકારના ધ્યેયોમાં કરવામાં આવેલ છે ?	(A) જ્ઞાનપ્રાપ્તિનાં ધ્યેયો	(B) સામાજિક ધ્યેયો	(C) વ્યક્તિગત ધ્યેયો	(D) આ પૈકી કોઈ નહીં
36	કેળવણીનાં ધ્યેયો પર અસર કરતાં પરિબલોની કુલ સંખ્યા કેટલી છે ?	(A) એક	(B) બે	(C) ત્રણ	(D) ચાર
37	કોઠારી પંચનો અહેવાલ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો ?	(A) ઈ.સ. 1964	(B) ઈ.સ. 1993	(C) ઈ.સ. 1996	(D) ઈ.સ. 2011
38	16મી ડિસેમ્બર, 1993માં યુનેસ્કોમાં થયેલ શિખર સંમેલન (પરિષદ)માં કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો ?	(A) 15	(B) 9	(C) 7	(D) 21
39	"નાસ્તિ વિદ્યાસ્મૃ ચક્ષુઃ" ઉક્તિ કયા ધાર્મિક ગ્રંથમાંથી લેવામાં આવી છે ?	(A) રામાયણ	(B) ઉપનિષદ	(C) મહાભારત	(D) બાલમંદૂકીયા
40	નીચે પૈકી શું કેળવણીની નીપજમાં સમાવેશિત નથી ?	(A) સત્યની શોધ	(B) શૈક્ષણિક સાધન	(C) માનવશક્તિનો વિકાસ	(D) જ્ઞાનપ્રાપ્તિ પરિવર્તન
41	ઈલિઝબેથ ફરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે ?	(A) પ્રગતિગામી	(B) ગુણાત્મક	(C) પ્રમાણાત્મક	(D) આ પૈકી કોઈ નહીં
42	સંક્રાંતિકાળની અવસ્થા એટલે ...	(A) કિશોરાવસ્થા	(B) યુવાવસ્થા	(C) તરૂણાવસ્થા	(D) વૃદ્ધાવસ્થા
43	મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણે હતા ?	(A) મેસ્લો	(B) ફ્રોઈડ	(C) જુનપિયાજે	(D) ઈલિઝબેથ
44	'તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા' એ કયા પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટી છે ?	(A) વ્યક્તિગત કસોટી	(B) શાબ્દિક કસોટી	(C) શાબ્દિક સમૂહ કસોટી	(D) ક્રિયાત્મક કસોટી
45	નીચે પૈકી કયા મનોવૈજ્ઞાનિકે અશાબ્દિક કસોટીઓ આપી છે ?	(A) ડૉ. એન.એન.શુક્લ	(B) ડૉ. ભાટિયા	(C) શ્રીમતી પ્રમિલા કાટક	(D) શ્રી પી. ડી. પટેલ
46	"એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી." - આ કયા પ્રકારની બચાવ પ્રથુક્તિ છે ?	(A) અલિપતા	(B) યોક્તિકીકરણ	(C) દમન	(D) પ્રસેપણ
47	"કોઈ વ્યક્તિ પોતાનું વયસ્વ સ્થાપવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાની, હસવા-હસાવવાની આદતો વિકસાવી પોતાની જાતને સુધારક કે પ્રગતિશીલ માને છે." - આ કયા પ્રકારની બચાવ પ્રથુક્તિ છે ?	(A) ક્ષતિ પૂર્તિ	(B) તાદાત્મ્ય	(C) પ્રસેપણ	(D) ધ્યાનાકર્ષણ
48	ફ્રાંસના ડૉ. આલ્ફ્રેડ બિને અને સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપનના કાર્યનો આરંભ કર્યો હતો ?	(A) ઈ.સ. 1905	(B) ઈ.સ. 1907	(C) ઈ.સ. 1904	(D) ઈ.સ. 1903
49	અધિક સામાન્ય બુદ્ધિક્ષણ ધરાવતા બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે ?	(A) 140 થી વધુ	(B) 120 થી 129	(C) 110 થી 119	(D) 130 થી 139
50	'અંગુલી ચાપલ્ય કસોટી' - આ પ્રકારની ક્રિયાત્મક કસોટી કોણે આપી હતી ?	(A) ડૉ. ભાટિયા	(B) ડૉ. છાયાબેન મૂલવાણી	(C) ડૉ. આર.એસ. પટેલ	(D) ડૉ. આર.એન. કાકર
51	વ્યક્તિગત સિદ્ધાંતની સંકલ્પના પરથી તેનાં કુલ કેટલાં ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવે છે ?	(A) 6	(B) 7	(C) 9	(D) 12
52	'વર્તમાનકાળનો અનુભવ ભૂતકાળ જેવો જ છે.' એવું સમજાવતો અનુભવ એટલે ...	(A) પુનઃપ્રાપ્તિ	(B) પ્રત્યભિન્ના	(C) સંચય	(D) સંકેતાકન

53	"Lieutenant Blandford <u>did not hesitate</u> ." put correct word/words in place of underlined words. (A) showed in decision. (B) felt unhappiness. (C) called back. (D) did not show indecision.
54	The word 'frenzy' means ..... (A) violent fury (B) temporary madness (C) astonished (D) wild
55	The phrase "nook and corner" - means what ? (A) on the bank of a river (B) in one side (C) opposite side (D) in all the direction
56	The verb of cloth is _____ ? (A) clothes (B) encloth (C) cloothe (D) clothe
57	Do you _____ in your friend ? (A) confident (B) confide (C) confidently (D) None
58	" The worst problem of India is over population. " Change the degree. (A) No other population of India is as bad as over population. (B) Over population is a very bad problem of India. (C) Over population is more worst than any other problem. (D) The worse problem of India is over population.
59	Could you _____ anything from the principal's speech ? put correct phrase. (A) make in (B) make up (C) make out (D) make with
60	"Let's have some rest." he said. Change the speech. (A) He said that he would take rest. (B) He suggested having some rest. (C) He questioned to take rest. (D) He exclaimed having some rest.
61	They grew these trees five years ago. Change the voice. (A) These trees are being grown by them five years ago. (B) These trees have been grown by them five years ago. (C) These trees were grown by them five years ago. (D) These trees are grown by them five years ago.
62	The word <u>rake</u> means _____ ? (A) wild animal (B) creature (C) a tool (D) story
63	Don't <u>give away</u> to your fear and despair if you want to succeed. Put correct word in place of underlined words. (A) forget (B) look for (C) submit (D) deny
64	He did not care for health. He did not care for wealth. - Join the sentences with appropriate conjunction. (A) He care neither wealth or health. (B) He cares either for wealth or health. (C) He has to care neither wealth and health. (D) He cared neither for health nor for wealth.
65	Be careful or you will lose the chance. ( use if ) (A) If you will be careful, you will lose the chance. (B) If you are careless, you will not lose the chance. (C) If you are careful, you will not lose the chance. (D) If you are careful, you will lose the chance.
66	The problem was too difficult to solve. ( Remove too ) (A) The problem is so difficult that one cannot solve it. (B) The problem was so difficult that one could not solve it. (C) The problem is so difficult to be solved. (D) The problem was very difficult that it will be solved.
67	Every rose has a thorn. ( Make it Negative ) (A) There is no rose but has a thorn. (B) There is rose with a thorn. (C) There is no rose and has a thorn. (D) There are roses without thorns.

68	બંધારણની જોગવાઈઓને સમજવા માટે હેઠાના સમાન કાર્ય કોણ કરે છે ?	(A) આમુખ	(B) બંધારણ	(C) કાયદાઓ	(D) કલમો
69	નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?	(A) રઘુવીર ધૌધરી	(B) રમણલાલ દેસાઈ	(C) લાલશંકર દાકર	(D) પીતાંબર પટેલ
70	ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ક્યા લેખકને અપાયો હતો ?	(A) શાંતિ ભટ્ટ	(B) તારક મહેતા	(C) ભગવતીકુમાર શર્મા	(D) સુરેશ દલાલ
71	આપણી જોડશાહી વ્યવસ્થામાં દેશના સૌથી પાયાના એકમ તરીકે કોનો સમાવેશ થાય છે ?	(A) ગ્રામ પંચાયત	(B) જિલ્લા પંચાયત	(C) તાલુકા પંચાયત	(D) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
72	મરહુમન સૌથી કાર્યશીલ, પ્રભાવશાળી અને નજરની સામે રહેલું અંગ એટલે ...	(A) રાજ્યસભા	(B) લોકસભા	(C) કારોબારી	(D) નાણાં સમિતિ
73	ઝિંસરીનનો વક્રીભવનો ક કેટલો છે ?	(A) 1.36	(B) 1.47	(C) 1.44	(D) 1.50
74	બોહાઈટના ઉત્પાદનમાં ભારત દેશ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ?	(A) પ્રથમ	(B) દ્વિતીય	(C) તૃતીય	(D) ચતુર્થ
75	ટેબલ ટેનિસની રમત સૌ પ્રથમ ક્યાં રમાઈ હતી ?	(A) ઈંગ્લેન્ડ	(B) ભારત	(C) વેસ્ટ ઈન્ડિઝ	(D) ઓસ્ટ્રેલિયા
76	નીચેનામાંથી કઈ નવલકથા ક.મા.મુનશી રચિત નથી ?	(A) જય સોમનાથ	(B) પાટણની પ્રભુતા	(C) કરણધેલો	(D) ગુજરાતનો નાથ
77	ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?	(A) જયશંકર સુદરી	(B) દીના પાઠક	(C) હરેન્દ્ર ત્રિવેદી	(D) બાપુલાલ નાયક
78	મરાઠા રાજ્યના દ્વિતીય ઉદ્ધારક તરીકે કોને ઓળખવામાં આવે છે ?	(A) રાજા રામમોહનરાય	(B) બાલાજી વિશ્વનાથ	(C) બાલાજી બાજુરાવ	(D) છત્રપતિ શિવાજી
79	ઈ.સ. 1976 માં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલા ધજાળા ગામમાં કેટલા વજનની ઉલ્કા પડી હતી ?	(A) 40 Kg	(B) 50 Kg	(C) 60 Kg	(D) 160 Kg
80	સંપૂર્ણ ભારતીય સંઘનો દક્ષિણતમ છેડો કયો છે ?	(A) ઈન્દિરા પોલ	(B) ઈન્દિરા પોઈટ	(C) મજાર	(D) કન્યાકુમારી
81	બેડમિન્ટન ક્ષેત્રે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડીનું નામ શોધો.	(A) પી. વી. સિંધુ	(B) સાઈના નહેવાલ	(C) કેરોલિના મેટીન	(D) સાક્ષી મલિક
82	ક્યા દિવસને 'વિશ્વ શ્રમ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?	(A) 1 <sup>st</sup> May	(B) 2 <sup>nd</sup> May	(C) 3 <sup>rd</sup> May	(D) 4 <sup>th</sup> May
83	"કુદરત દ્વારા મળતી ડેઝવર્સી જ સાચી ડેઝવર્સી છે." - વિધાન ક્યા શિક્ષણશાસ્ત્રીનું છે ?	(A) રૂમો	(B) પેસ્ટોલોજી	(C) એરિસ્ટોટલ	(D) ગાંધીજી
84	ડેઝવર્સીની સંકલ્પનાના આધારે શું સાચું નથી ?	(A) આજીવન પ્રક્રિયા છે.	(B) અનુકૂળનની પ્રક્રિયા છે.	(C) આર્થિક સફરતા વધારવાની પ્રક્રિયા છે.	(D) સંસ્કારની પ્રક્રિયા છે.
85	ડેઝવર્સીની ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સંભોની સંખ્યા કેટલી છે ?	(A) બે	(B) ત્રણ	(C) ચાર	(D) એક

86	કયા પ્રકારના સંશોધનમાં ઉપચારાત્મક શિક્ષણકાર્યને સ્થાન મળે છે ? (A) ક્રિયાત્મક સંશોધન (B) મૂલગત સંશોધન (C) વ્યાવહારિક સંશોધન (D) તમામ
87	ZCBA, YFED, XIHG, _____ ? (A) WLKM (B) WJKL (C) WKIJ (D) WLKJ
88	આપેલ શ્રેણીમાં ખૂટતા મૂળાક્ષર શોધો. bc <u>c</u> b <u>b</u> c <u>c</u> b <u>b</u> ccb (A) cbcb (B) bbcb (C) cbbc (D) bcbc
89	શ્રેણી પૂર્ણ કરો. 121, 225, 361, ..... (A) 484 (B) 529 (C) 729 (D) 441
90	પ્રશ્નાર્થના ખાનામાં યોગ્ય અંક કયો આવશે ? (A) 6 (B) 9 (C) 12 (D) 10
	
91	એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતાં આશાએ કહ્યું, "આ માણસ મારી બહેનના ભાઈના પિતાનો એકનો એક પુત્ર છે." આ વ્યક્તિ આશાનો શું સગો થતો હશે ? (A) મામા (B) માતા (C) ભાઈ (D) એકપણ નહિ
92	19 જુલાઈ, 1919 ના રોજ અઠવાડિયાનો કયો વાર હતો ? (A) સોમવાર (B) રવિવાર (C) શનિવાર (D) બુધવાર
93	રમેશ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ મો રાખીને ઊભો છે. તે ઘડિયાળની દિશામાં 90° ફરે છે. એ પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180° ફરે છે. આ જ દિશામાં ફરીથી 90° ફરે છે. હવે તેનું મો કઈ દિશામાં હશે ? (A) દક્ષિણ પૂર્વ (B) દક્ષિણ (C) પશ્ચિમ (D) દક્ષિણ-પશ્ચિમ
94	રવિ એક લાઈનમાં જમણી બાજુથી ચોથો છે. જ્યારે શ્યામ ડાબી બાજુથી બીજો છે. જો તે અરસ-પરસ સ્થાન બદલે તો રવિ જમણી બાજુથી નવમો થાય તો શ્યામ ડાબી બાજુથી કયા ક્રમે હશે ? (A) આઠમો (B) સાતમો (C) છઠ્ઠો (D) પાંચમો
95	યશ, જય કરતાં બે વર્ષ મોટો છે. જય હેમંત કરતાં ત્રણ વર્ષ નાનો છે. અંકુર હર્ષિત કરતાં એક વર્ષ મોટો છે. પણ હેમંત કરતાં ચાર વર્ષ મોટો છે. તો સૌથી મોટું કોણ છે ? (A) અંકુર (B) હર્ષિત (C) યશ (D) જય
96	આપેલ શબ્દ INFRASTRUCTURE માંથી કયો શબ્દ બનાવી શકાય નહિ ? (A) STRUCTURE (B) INSTRUCTOR (C) INTACT (D) FRITTER
97	કોઈ ચોક્કસ સંજામાં CANDLE ને FDQGOH લખાતું હોય તો MINUTE ને કઈ રીતે લખાય ? (A) HOGQDF (B) DLECAN (C) LPXQHD (D) PLOXWH
98	જો સરવાળા માટે x, બાદબાકી માટે + અને ગુણાકાર માટે * હોય તો $20 \times 8 \div 4 + 2 =$ _____ (A) 12 (B) 24 (C) 25 (D) 5
99	જો આલ્ફાબેટના 19 થી 26 મૂળાક્ષરો ઊલટા ક્રમમાં લખવામાં આવે તો ડાબી બાજુથી 20 મો અક્ષર કયો હશે ? (A) T (B) S (C) U (D) V
100	નીચેનામાંથી કઈ આકૃતિ બધાથી જુદી પડે છે ? (A)  (B)  (C)  (D)  (E)  (A) આકૃતિ-A (B) આકૃતિ-B (C) આકૃતિ-C (D) આકૃતિ-E

101	<p>દક્ષિણથી ઉત્તરના ક્રમાંબુસાર નીચે દર્શાવેલ ભારતની નદીઓનો કયો ક્રમ સાચો છે ?</p> <p>(A) કાવેરી નદી, ગોદાવરી નદી, નર્મદા નદી, ચંબલ નદી                  (B) કાવેરી નદી, ગોદાવરી નદી, ચંબલ નદી, નર્મદા નદી                  (C) કાવેરી નદી, નર્મદા નદી, ગોદાવરી નદી, ચંબલ નદી                  (D) ચંબલ નદી, નર્મદા નદી, ગોદાવરી નદી, કાવેરી નદી</p>
102	<p>ભારતમાં આવેલ આ જંગલોમાં અબનુસ, રોજવુડ, મેહોગની જેવા વૃક્ષો થાય છે. સામાન્ય રીતે વૃક્ષો 60 મી. જેટલા ઊંચા હાય છે. ઝાડી-ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય આ વર્ણન કયા જંગલોને લાગુ પડે છે ?</p> <p>(A) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (B) ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો                  (C) સમશિતોષ્ણ કટિબંધીય જંગલો (D) ભરતીના જંગલો</p>
103	<p>નીચે આપેલ પર્યાવરણલક્ષી દિવસોને તેમના ઉજવણીના માસ પ્રમાણે ગોઠવતા ( જાન્યુઆરી થી ડિસેમ્બર પ્રમાણે ) કયો ક્રમ સાચો છે ?</p> <p>(A) વિશ્વ વન દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ, વિશ્વ ઓઝોન દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ                  (B) વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ ઓઝોન દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ                  (C) વિશ્વ પૃથ્વી દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ ઓઝોન દિવસ, વિશ્વ વન દિવસ                  (D) વિશ્વ વન દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ ઓઝોન દિવસ</p>
104	<p>સાચુ જોડકું જોડી યોગ્ય ક્રમ પસંદ કરો.</p> <p>P - નાસિક 1. કુંભ મેળો                  Q - અલાહાબાદ 2. તરણેતરનો મેળો                  R - થાનગઢ 3. ભવનાથનો મેળો                  S - જુનાગઢ 4. અધકુંભ મેળો</p> <p>(A) P-4,Q-2,R-3,S-1 (B) P-4,Q-1,R-2,S-3 (C) P-4,Q-1,R-3,S-2 (D) P-1,Q-2,R-3,S-4</p>
105	<p>નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?</p> <p>(A) આઝ્મચ ખડક - બેસાલ્ટ (B) પ્રસ્તર ખડક - ધિરોડી ( જિપ્સમ )                  (C) રૂપાંતરિત ખડક - કોલસો (D) રૂપાંતરિત ખડક - આરસપહાણ</p>
106	<p>સાચું જોડકું જોડી યોગ્ય ક્રમ પસંદ કરો.</p> <p>a- કિંમતી ધાતુમય ખનિજ - 1. બોક્સાઈટ                  b- હલકી ધાતુમય ખનિજ - 2. વેનેડિયમ                  c- સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ - 3. ચાંદી                  d- મિશ્ર ધાતુ રૂપે વપરાતો ખનિજ - 4. કલાઈ</p> <p>(A) a-3,b-1,c-4,d-2 (B) a-3,b-2,c-4,d-1 (C) a-2,b-4,c-1,d-3 (D) a-3,b-2,c-1,d-4</p>
107	<p>નીચે આપેલ સત્તાઓ પૈકી કઈ સત્તા રાષ્ટ્રપતિ ધરાવતા નથી ?</p> <p>(A) અન્ય રાષ્ટ્રો સામે યુધ્ધ જાહેર કરવાની, યુધ્ધ બંધ કરવાની કે સંધી કરવાની સત્તા છે.                  (B) વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.                  (C) હોદ્દાની રૂએ તે રાજ્યસભાના સભાપતિ છે.                  (D) સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલત્વી રાખવાની રાષ્ટ્રપતિને સત્તા છે.</p>
108	<p>મોહે-જો-દડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા અને તે એક બીજાને કઈ રીતે મળતા હતા ?</p> <p>(A) નગરના રસ્તાઓ 6.0 મીટર પહોળા હતા અને એક બીજાને સમાંતર પસાર થતા હતા.                  (B) નગરના રસ્તાઓ 7.0 મીટર પહોળા હતા અને એક બીજાને ગોળાકારે મળતા હતા.                  (C) નગરના રસ્તાઓ 8.50 મીટર પહોળા હતા અને નગર બહાર એકબીજાને ગોળાકારે મળતા હતા.                  (D) નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા અને એકબીજાને કાટખૂણે મળતા હતા.</p>

109	ભારત દેશના નીચે દર્શાવેલ વિવિધ રાજ્યના પાટનગરોને તેમના સ્થાન પ્રમાણે પાંચમથી પૂવના ક્રમમાં ગાઠવતા કયા વિકલ્પ સાચો બનશે ? 1. ગાંધીનગર 2. ચૈઝવાલ 3. રાંચી 4. રાયપુર (A) 1, 2, 3, 4 (B) 1, 4, 3, 2 (C) 1, 4, 2, 3 (D) 2, 3, 4, 1
110	લોક અદાલતના સંદર્ભમાં અહીં કેટલાક વિધાનો લખવામાં આવેલ છે. કયું વિધાન લોક અદાલત માટે અસંગત છે ? (A) લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સમંતિથી સ્વૈચ્છિક ધોરણે યોજવામાં આવે છે. (B) લોક અદાલતમાં વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ આવે છે. (C) લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ નથી. (D) ગરીબો અને શોષીતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે લોક અદાલતની રચના કરવામાં આવી છે.
111	નીચે આપેલા જોડકા જોડી સાચો ઉત્તર લખો. a- માનવહક દિન - 1. 15 ઓગષ્ટ b- મૂળભૂત ફરજ દિન - 2. 26 જાન્યુઆરી c- પ્રજાસત્તાક દિન - 3. 6 જાન્યુઆરી d- સ્વાતંત્ર્ય દિન - 4. 10 ડિસેમ્બર (A) a-3, b-4, c-2, d-1 (B) a-4, b-3, c-2, d-1 (C) a-3, b-4, c-1, d-2 (D) a-4, b-1, c-2, d-3
112	અહીં વધુ ઊંચાઈ ધરાવતા કેટલાક પર્વતોની યાદી આપેલ છે. તેને વધુ ઊંચાઈ ધરાવતાથી ઓછી (નીચી) ઊંચાઈ ધરાવતા પર્વત પ્રમાણે ગોઠવતા કયો ક્રમ સાચો છે ? M-કાંચનજંઘા N-માઉન્ટ ગોડવિન ઓસ્ટ્રીન O-મકાલુપ- ધવલગિરિ (A) M, N, O, P (B) N, M, O, P (C) N, M, P, O (D) N, P, O, M
113	ભારતના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણીના રાજ્ય સાથેની જોડ અહીં આપેલ છે. તેમાંથી કઈ જોડ ખોટી છે ? (A) કાન્હા - મધ્યપ્રદેશ (B) બાંદીપુર - ઓડિશા (C) કેવલા દેવ - રાજસ્થાન (D) દયિગામ-જમ્મુ-કાશ્મીર
114	નીચે આપેલ ઐતિહાસિક ઘટનાઓને તેના બનાવના ક્રમ મુજબ ગોઠવતા પહેલા બનેલ બનાવ પહેલા આવે તે પ્રમાણે કયો ક્રમ સાચો છે ? P - પેરીસ શાંતિ પ્રક્રિયા Q-લોહીયાળ રવીવાર R-ફ્રેન્કફર્ટની સમજૂતી S-બોલ્શેવિક ક્રાંતિ (A) P, Q, R, S (B) R, Q, P, S (C) R, Q, S, P (D) R, P, G, S
115	નીચે આપેલા જોડકા જોડી સાચો ઉત્તર લખો. a-અસીમા ચેટરજી - 1. વનસ્પતિશાસ્ત્ર b-શકુંતલા દેવી - 2. તબીબીશાસ્ત્ર c- જાનકી અમ્મા - 3. રસાયણશાસ્ત્ર d-ડૉ. ઈન્દિરા આહુજા - 4. ગણિતશાસ્ત્રમાં માનવ સંગકણ (A) a-4, b-1, c-2, d-3 (B) a-4, b-2, c-3, d-1 (C) a-3, b-4, c-2, d-1 (D) a-3, b-4, c-1, d-2
116	નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? (A) સાયમન કમિશનની નિમણૂંક માર્લેમિન્ટે સુધારાની એક જોગવાઈને અનુલક્ષીને કરવામાં આવી હતી. (B) સાયમન કમિશન બાદ રચાયેલ નેહરુ કમીટીના પ્રમુખ મોતીલાલ નેહરુ હતા. (C) પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પસાર થયો તેના અધ્યક્ષ જવાહરલાલ નેહરુ હતા. (D) સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાહોરમાં સંરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી.



117	કુતુબ મિનારનું નિર્માણ ક્યારે કોણે શરૂ કરાવેલ ? (A) 13મી સદીમાં ઈલ્તુત્મીશે શરૂ કરાવેલ (B) 12મી સદીમાં કુતુબુદ્દીન ચૈબકે શરૂ કરાવેલ (C) ઈ.સ. 1565માં અકબરે શરૂ કરાવેલ (D) ઈ.સ. 1630માં શાહજહાં એ શરૂ કરાવેલ
118	કુદરતી સંસાધન ક્યારે બને છે ? (A) જમીનમાં દટાયેલ ખનીજોની જાણકારીથી બને છે. (B) જમીનમાં દટાયેલ ખનીજોને બહાર કાઢવાથી બને છે. (C) ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા ન હોય તો પણ બને છે. (D) કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયાથી બને છે.
119	ક્યા રાજ્યને 'ઘઉંનો કોહાર' કહેવામાં આવે છે ? (A) મધ્યપ્રદેશ (B) ગુજરાત (C) પંજાબ (D) મહારાષ્ટ્ર
120	વિશ્વમાં ગુજરાત ક્યા પાકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે ? (A) ધાણા, મેથી અને કરિયાતાના ઉત્પાદનમાં (B) જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં (C) રાઈ, સુવા અને અજમાના ઉત્પાદનમાં (D) અશ્વગંધા, લીડીપીપર અને કુદીનોના ઉત્પાદનમાં
121	ભારતમાં હરિયાણી ક્રાંતિથી ક્યા પાકમાં વિક્રમ જનક ઉત્પાદન થયું છે ? (A) કઠોળ અને તેલિબિયાના પાક (B) ઘઉં અને ડાંગરનો પાક (C) કપાસ અને બટાકાના પાક (D) મગફળી અને શેરડી
122	કાંપની જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે ? (A) નદીઓ દ્વારા ઠલવાતા કાંપને કારણે (B) લાવારસ પથરાવાથી (C) વૃક્ષોના ખરેલા પાંદડા સડવાથી (D) તોફાની પવનોથી જમીનના કણો પથરાવાથી
123	પાણીની અછત સત્ત વધતી જવાનું શું કારણ છે ? (A) પાણી વિતરણની અસમાનતા (B) પાણીની માંગ અને પુરવઠા વચ્ચે અસમતોલન (C) પાણીના તળ ઊંડા જવાથી (D) વસતિ વધારો અને રોકડિયા પાકનું ઉત્પાદન
124	જળ સંરક્ષણ માટે અગત્યનો ઉપાય જણાવો. (A) વૃક્ષારોપણ કરવું (B) વનીકરણ કરવું (C) વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું (D) બંધ પાળા બાંધવા
125	ભારતમાં સૌથી વધુ લોખંડ ક્યા રાજ્યમાંથી મળે છે ? (A) છત્તીસગઢ (B) મધ્યપ્રદેશ (C) અસમ (D) કર્ણાટક
126	વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલ છે ? (A) ન્યૂયોર્ક (B) જીનીવા (C) હેગ (D) મોસકો
127	મનરેગા યોજનામાં નાણાકીય વર્ષમાં કેટલા દિવસની સવેતન રોજગારી આપવાની જોગવાઈ છે ? (A) પંચાશી દિવસ (B) નેવું દિવસ (C) સો દિવસ (D) એશી દિવસ
128	આયોની રાજકીય સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન ક્યા ગ્રંથમાં કરવામાં આવેલ છે ? (A) સામવેદ (B) ઋગ્વેદ (C) યજુર્વેદ (D) અથર્વવેદ
129	પ્રાચીન સમયમાં વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કોણે કરી હતી ? (A) આચાર્ય નાગાર્જુન (B) મહર્ષિ ચરક (C) મહર્ષિ સુશ્રુત (D) આર્યભટ્ટ
130	એલિફન્ટાની કુલ કેટલી ગુફાઓ છે અને તેની સર્વોત્તમ શિલ્પકૃતિ કઈ છે ? (A) તેની કુલ સાત ગુફાઓ છે અને સર્વોત્તમ શિલ્પ બુધ્ધનું છે. (B) તેની કુલ છ ગુફાઓ છે અને સર્વોત્તમ શિલ્પ વિષ્ણુનું છે. (C) એલિફન્ટાની કુલ સાત ગુફાઓ છે અને તેનું સર્વોત્તમ શિલ્પ ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું છે. (D) તેની છ ગુફાઓ છે અને સર્વોત્તમ શિલ્પ દુર્ગાદેવીનું છે.

131	નીચે પૈકી કયુ માઈક્રો ટીચીંગનું સોપાન નથી ? (A) સૂક્ષ્મ પાઠનુ આયોજન (B) શિક્ષણ (C) પુન: આયોજન (D) નિરીક્ષણ
132	નીચેના પૈકી કઈ પ્રયુક્તિ અનુબંધ સાધવા માટેની પ્રયુક્તિ નથી ? (A) કથન (B) કુદરતી પ્રદેશ (C) પ્રશ્નોતરી (D) ચર્ચા
133	નીચે આપેલ માઈક્રો ટીચીંગના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. 1. પુન: આયોજનનો તબક્કો 2. પુન: શિક્ષણનો તબક્કો 3. પ્રતિપોષણનો તબક્કો 4. શિક્ષણનો તબક્કો 5. પુન: પ્રતિપોષણનો તબક્કો (A) 4, 3, 2, 1, 5 (B) 2, 4, 5, 3, 1 (C) 4, 3, 1, 2, 5 (D) 4, 3, 1, 5, 2
134	કરૂણા, સંપ, સમભાવ એ કેવા પ્રકારનાં મૂલ્યો છે ? (A) સામાજિક (B) નૈતિક (C) ધાર્મિક (D) રાજકીય
135	પ્રોજેક્ટ પદ્ધતિ એટલે... (A) પ્રોજેક્ટ / કમ્પ્યુટર દ્વારા રજૂઆત. (B) વિવિધ શૈક્ષણિક સાધનો દ્વારા રજૂઆત (C) દસ્તાવેજો અને આધારો સાથે શિક્ષણ (D) કુદરતી વાતાવરણમાં થતું સમસ્યા ઉકેલ શોધવાનું કાર્ય
136	શિક્ષણકાર્યની શરૂઆત કરતા પહેલા શિક્ષકે નીચે પૈકી કયા કોશલ્યનો ઉપયોગ કરવો જોઈએ ? (A) કા.પા.કોશલ્ય (B) પ્રશ્ન પ્રવાહિતા (C) ઉદારણ (D) વિષયાભિમુખ
137	જો શિર્ષાસનની સ્થિતિમાં પરેશનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોય તો તેનો કાબો હાથ કઈ દિશામાં હશે ? (A) ઉત્તર (B) દક્ષિણ (C) પૂર્વ (D) પશ્ચિમ
138	નકશા માટે નીચે પૈકી કયુ વિધાન સાચુ છે ? 1. શિક્ષકે વિદ્યાર્થીઓને ગુગલ અર્થનો ઉપયોગ કરી નકશો જોતા શીખવવું જોઈએ. 2. નકશામાં રંગો દ્વારા ભૌગોલિક બાબતો સમજાવી શકાય છે. 3. નકશાનો ઉપયોગ જમીન પરનાં વાસ્તવિક અંતર જાણવા માટે થઈ શકે છે. 4. ઉપરોક્ત તમામ (A) માત્ર વિધાન 1 જ (B) માત્ર વિધાન 1 અને 2 (C) માત્ર વિધાન 2 અને 3 (D) વિધાન 4
139	નીચે પૈકી કયુ ઉદાહરણ કોશલ્યનું ઘટક નથી ? (A) સરળ ઉદાહરણો (B) વિદ્યાર્થી સહયોગ (C) ઉદાહરણોની માત્રા (D) નિદર્શન
140	સિમ્યુલેશન પાઠને બીજા કયા નામે ઓળખી શકાય ? (A) પૂર્વ તૈયારી પાઠ (B) લઘુ પાઠ (C) અપૂર્ણ પાઠ (D) ઉપરમાંથી એકપણ નહીં
141	ઐતિહાસિક પાત્રોનાં અધ્યયન માટે નીચેના પૈકી સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? (A) આધાર (B) વાર્તા (C) વર્ણન (D) જીવન વૃત્તાંત
142	નીચેનામાંથી કયો એકમ મોક પદ્ધતિથી શીખવી શકાય ? (A) ગુજરાત : સ્થાન (B) સંસદ (C) ગામનો ઇતિહાસ (D) નકશો સમજીએ
143	વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસતા સમયે નીચે પૈકી કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય નહીં ? (A) ઉદાહરણ (B) મૂલ્યાંકન (C) નિદર્શન (D) ભૂમિકા નિર્માણ
144	સિમ્પોઝીયમ એટલે શું ? (A) ટૂંકી ચર્ચા (B) લાંબી ચર્ચા (C) સહસંવાદ (D) એક પણ નહીં

145	નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ એ કઈ પદ્ધતિનું વિકસિત સ્વરૂપ છે ? (A) પ્રોજેક્ટ (B) ચર્ચા (C) સ્વાધ્યાય (D) આધાર
146	રવિન્દ્રનાથ ટાગોરે કયો હેતુ સિદ્ધ કરવા શાંતિનિકેતનની સ્થાપના કરી હતી ? (A) પ્રકૃતિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ (B) પુસ્તક દ્વારા જ્ઞાન પ્રાપ્તિ (C) શિક્ષક દ્વારા જ્ઞાન પ્રાપ્તિ (D) શૈક્ષણિક સાધનો દ્વારા જ્ઞાન પ્રાપ્તિ
147	ભારત આવવાના જળમાર્ગ શોધવાના પ્રયત્નો દરમિયાન 'કેપ ઓફ ગુડ હોપ' ભૂશિરની શોધ કોણે કરી હતી ? (A) કોલંબસ (B) વાસ્કો-દ-ગામા (C) પ્રિન્સ હેનરી (D) બાથોલોમ્યુ ડાયઝ
148	ગાંધીજીના રાજકિય ગુરુ કોણ હતા ? (A) શ્રીમદ્ રાજચંદ્ર (B) ગોપાલકૃષ્ણ ગોખલે (C) રવીન્દ્રનાથ ટાગોર (D) લોકમાન્ય તિલક
149	સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? (A) ન્યુયોર્ક (B) હેગ (C) પેરીસ (D) જીનીવા
150	લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? (A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (B) ડૉ. બાબાસાહેબ આંબેડકર (C) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ (D) ગણેશ વાસુદેવ માવળંકર
151	ભારતમાં કેટલા વર્ષે નાગરિકોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ? (A) 18 વર્ષે (B) 22 વર્ષે (C) 20 વર્ષે (D) 15 વર્ષે
152	સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની છે ? (A) 62 (B) 65 (C) 60 (D) 58
153	વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને 'વિશ્વ વન વર્ષ' ઘોષીત કરવામાં આવેલ હતું ? (A) 2005 (B) 2011 (C) 2009 (D) 2014
154	સિંધુ નદીની શાખા નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી ? (A) નૂબરા (B) શ્યોક (C) કેનુલા (D) હુંજા
155	'અલ નીનો' જેનો શબ્દિક અર્થ 'નાનું બાળક' થાય છે. આ 'અલ નીનો' શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવેલ છે ? (A) જર્મન (B) હિબ્રુ (C) સ્પેનિશ (D) હિન્દી
156	'પોગલ' એ નીચેનામાંથી કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? (A) અસમ (B) તેલંગાણા (C) તમિલનાડું (D) મિઝોરમ
157	ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ કયાં આવેલ છે ? (A) પાટણ (B) જૂનાગઢ (C) મોઢેરા (D) વડનગર
158	અધ્યાપનકાર્ય દ્વારા નીચે પૈકી શું સિદ્ધ કરવાનું છે ? (A) હેતુઓ, વર્તન-પરિવર્તન કે ક્ષમતાઓ (B) વિષયવસ્તુ (C) વર્ગવ્યવહાર (D) શૈક્ષણિક મુદ્દાઓ
159	કઈ પદ્ધતિમાં સ્ક્રિપ્ટનું મહત્વ છે ? (A) પેનલ ચર્ચા (B) જૂથ ચર્ચા (C) સેમિનાર પદ્ધતિ (D) જીવન વૃત્તાંત
160	કોઈક વાસ્તવિક વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ અથવા પ્રક્રિયાનું અનુકરણ એટલે..... (A) માર્ફકોલેશન (B) નિદર્શન પાઠ (C) સિમ્યુલેશન (D) મેકોલેશન
161	વિવિધ કૌશલ્ય પ્રાપ્તિ માટે પ્રશિક્ષણાર્થીએ એક પછી એક કૌશલ્ય હસ્તગત કરવાનાં હોય છે. (A) સૂક્ષ્મ શિક્ષણમાં (B) હેતુકેન્દ્રી પાઠમાં (C) સેતુ પાઠમાં (D) સિમ્યુલેશનમાં

162	શાસ્ત્રકારોએ ભવાઈને કેવાં નાટકો કહ્યાં છે ? (A) સંગીતકલાનાં નાટકો (B) ગરબા નાટકો (C) નૃત્ય નાટકો (D) ભાવનાપ્રધાન નાટકો
163	ગુજરાતમાં ક્યાં હડપ્પાકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે ? (A) ધોળાવીરા (B) પાટણ (C) વડનગર (D) જૂનાગઢ
164	યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ગુજરાતની કઈ વાવનો સમાવેશ કર્યો છે ? (A) અડાલજની વાવ (B) દાદા હરિની વાવ (C) રાણીની વાવ (D) હીરા ભાગોળ
165	શૂન્યની શોધ કોણે કરી હતી ? (A) મહર્ષિ ચરક (B) મહર્ષિ સુશ્રુત (C) વરાહ મિહિર (D) આર્યભટ્ટ
166	કેવા જંગલોમાં વૃક્ષો કાપવા અને પશુચરાણ માટે પ્રવેશ પ્રતિબંધ છે ? (A) સંરક્ષિત જંગલ (B) અનામત જંગલ (C) અવર્ગીકૃત જંગલ (D) સામુદાયિક જંગલ
167	વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારત કેટલામે ક્રમે છે ? (A) પહેલા (B) બીજા (C) ત્રીજા (D) ચોથા
168	શણ ઉત્પાદનમાં ભારતે કોની સાથે હરીફાઈ કરવી પડે છે ? (A) ચીન (B) પાકિસ્તાન (C) બાંગ્લાદેશ (D) મ્યાનમાર
169	વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલ છે ? (A) ગુવાહાટી (B) જામનગર (ગુજરાત) (C) મથુરા (D) કોચલી
170	ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યાં શરૂ થઈ હતી ? (A) કલકત્તાથી હવરા વચ્ચે (B) ચેન્નાઈથી પુડુચેરી વચ્ચે (C) અમદાવાદથી વડોદરા વચ્ચે (D) મુંબઈથી થાણા વચ્ચે

Adda247